

B.Ed. Semester - 1 (CBCS) Examination
Oct/Nov. -2019 (NEW COURSE)
ECONOMICS (SELF STUDY COURSE)

Time: 1:15 Hours

Marks: 35

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન : ૧ નીચેના પ્રત્યેક પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો.

(૦૫)

- ૧.૧) અર્થશાસ્ત્ર વિષયમાં આંકડાકીય માહિતીની ઉપયોગીતા લખો.
- ૧.૨) પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે?
- ૧.૩) ઉત્પાદનનાં સાધનો કેટલા છે? કયાં-કયાં?
- ૧.૪) ટકાઉ વસ્તુનો અર્થ જણાવો.
- ૧.૫) પૂર્ણ હરીફાઈવાળું બજાર એટલે શું?

પ્રશ્ન : ૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોનાં ઉત્તર આપો.

(૧૦)

- ૨.૧) માંગના નિયમનાં અપવાદ લખો. (કોઈપણ બે મુદ્દા)
- ૨.૨) ગિફ્ટ વસ્તુ એટલે શું?
- ૨.૩) આવક અસર અને અવેજી અસરનો અર્થ આપો.
- ૨.૪) પુરવઠાનો વધારો-ઘટાડો સમજાવો.
- ૨.૫) અર્થશાસ્ત્રનાં પિતા કોને ગણવામાં આવે છે?
- ૨.૬) માંગ એટલે શું?

પ્રશ્ન : ૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોનાં સવિસ્તાર ઉત્તર આપો.

(૨૦)

- ૩.૧) સંપત્તિનો અર્થ આપી સંપત્તિનાં લક્ષણો વિગતે સમજાવો.
- ૩.૨) ઉત્પાદન ખર્ચનાં વિવિધ ખ્યાલોની સમજૂતી આપો.
- ૩.૩) પુરવઠાનો નિયમ લખી તેને અસર કરતા પરિબલો જણાવો.
- ૩.૪) માંગની મુલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો.
- ૩.૫) વ્યાપાર ચક્રનો અર્થ આપી તેના લક્ષણો જણાવો.
- ૩.૬) માંગની મુલ્ય સાપેક્ષતા અને માંગની પ્રતિ મુલ્ય સાપેક્ષતા વચ્ચેનો તફાવત સમજાવો.

ENGLISH VERSION

Question : 1 Answer each of the following questions briefly.

[05]

- 1.1) Write the usefulness of statistical data in economics.
- 1.2) What is the slope of the supply line?
- 1.3) What is the production equipment? Where?
- 1.4) Explain the meaning of a durable item.
- 1.5) What is a fully competitive market?

Question : 2 Answer any of the five questions below.

[10]

- 2.1) Write exceptions to the demand rule. (Any two issues)
- 2.2) What is the Giffen thing?
- 2.3) Give the meaning of the income effect and the substitution effect.
- 2.4) Explain the increase and decrease of supply.
- 2.5) Who is considered the father of economics?
- 2.6) What is demand?

Question : 3 Answer the five questions in detail below.

[20]

- 3.1) Explain the meaning of wealth in detail.
- 3.2) Explain various concepts of production costs.
- 3.3) Write down the supply rule and state the factors affecting it.
- 3.4) Explain the types of diagrams illustrating the value relative to demand.
- 3.5) Explain the meaning of the business cycle.
- 3.6) Explain the difference between the price relative to demand and the relative cost to demand.
